પ્રચાર પ્રસાર
॥ સનાતન પરમો ધર્મ ॥
સનાતન ધર્મ પત્રિકા
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર
This edition is for internal circulation of members of ABKKP Social Association
SOCIAL MEDIA USE ONLY
જાગૃત ઉજાગર
સ્થાપના:
સં -૨૦૮૦ | અષાઢ વદ - ૦૩ | તા.૨૪-૦૭-૨૦૨૪ | બુધવાર | SDP No.: 1549 | MOB.:+91 7801877774, +91 7718977774 | ankasantandharmpatrika@gmail.com

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ

યુવા કોન્કલેવ - લોગો સ્પર્ધા

શ્રી અ.ભા.ક.ક.પા. યુવાસંઘ આયોજીત યુવા કોન્કલેવ - લોગો સ્પર્ધા

જ્યારે સમગ્ર દુનિયા ડિજિટલ યુગમાં જીવી રહી છે, અને આજનું યુવાધન જ્યારે ભવિષ્ય માટે અકલ્પનીય અને અશકય એમ લાગતા વિચારોને શક્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે આપણા કચ્છ કડવા પાટીદારના યુવાઓને તક છે. યુવાઓની ક્ષમતા અને સર્જનતાને ઓળખી તેમને વિકાસના એમ્બેસેડર બનાવવા માટે આ કોન્કલેવનું આયોજન થઈ રહ્યું છે.

આ યુવા કોન્કલેવ ઈવેન્ટના લોગોની ડિઝાઈન આપણા યુવાઓ દ્વારા જ થાય તે હેતુથી એક અસરદાર લોગો સ્પર્ધાનું આયોજન યુવા કોન્કલેવ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જે સભ્યનો લોગો ડિઝાઈન વિજેતા થશે તેને રૂ.૧૧૦૦૦/- નું રોકડ ઈનામ આપવામાં આવશે.

સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.

નિયમોઃ

૧. લોગોની ડિઝાઈન સ્પર્ધકોની પોતાની કલ્પનાની હોવી જોઈએ.

૨. લોગોની અંદર ઈવેન્ટનું નામ, ટેગ લાઈન યા આયોજકના નામમાંથી કોઈપણ એક વસ્તુનો જરૂરથી ઉપયોગ કરવો.

૩. લોગો કોઈ વેબસાઈટ યા અન્ય કોઈ પણ ઉપલબ્ધિથી કોપી કરેલ ન રહવો જોઈએ. કોપી કરેલ લોગોને માન્યતા આપવામાં આવશે નહીં.

૪. લોગો આ ઈવેન્ટ અને તેની થીમ ને લાગતો હોવો જોઈએ.

૫. લોગો ને હાઈરેસોલ્યુશન JPEG ફોર્મેટમાં મોકલવાનો રહેશે.

૬. સ્પર્ધકોને પોતાની વિગત અને પોતાનો લોગો આ મેસેજ સાથે આપેલ ફ્લાયરની અંદર ના QR કોડ થીજ મોકલવાનો રહેશે.

૭. લોગો મોકલવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪.

૮. લોગોનું ફાઈનલ સિલેક્શન નિષ્ણાંતો દ્વારા જ કરવામાં આવશે. જજીસનો નિર્ણય આખરી ગણાશે.

પણ તેમના અંદરની વિશેષ અને અદભૂત વિચાર શ્રેણીની સમગ્ર વિશ્વમાં પ્રદર્શિત કરવા હેતુ આપણા યુવાઓ દ્વારા અને આપણા યુવાઓ માટેનો જ એક વિશ્વ કક્ષાનો અનોખો કાર્યક્રમ યુવા કોન્કલેવનું ભવ્યતીભવ્ય આયોજન હાથ ધર્યું છે.

યુવાસંઘના ત્રિ-સ્તરીય માળખા (કેન્દ્ર, રીજીયન, યુવા મંડળ)ની અરસપરસની સંપર્કતા તેમજ યુવાસંઘની વ્યવસ્થાકીય અને કાર્યકારી માળખાને વધારો આપવા માટે આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે.

યુવા કોન્કલેવએ આપણા યુવાઓને તથા તેમના ભવિષ્યને ઘડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાની સુવર્ણ

ઈવેન્ટની વધુ માહિતી માટે લોગોન કરો
www.yuvaconclave.com

કેન્દ્રિય યુવાસંઘ - ૨૦૨૩-૨૦૨૫

રત્ન સન્માન ૨૦૨૩/૨૪

Rattn Sanman 2023-24
Recognition of our youth who has performed extraordinary in 2023-24 examinations

મિશન એજ્યુકેશન અને ટેલેન્ટ હન્ટ આયોજીત રત્ન સન્માન ૨૦૨૩-૨૪

જે વિદ્યાર્થી મિત્રોએ વર્ષ ૨૦૨૩-૨૪ ની પરીક્ષામાં વિશેષ સિદ્ધિ મેળવેલ છે તેવા ૫૯૧ યુવા રત્નોને સન્માનિત કરતા યુવાસંઘ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.

ભારતભરના ૨૩ રિજીયન માંથી આવેલ ઓનલાઇન એન્ટ્રીને વિશેષજ્ઞો દ્વારા ચકાસવામાં આવેલ. ગત વર્ષે ધોરણ ૧૦, ૧૨ (કોમર્સ, સાયન્સ, આર્ટસ) ના વિદ્યાર્થી રત્નોને સન્માનિત કરવામાં આવેલ. આ વર્ષે એક કદમ આગળ વધતા એન્જિનિયરિંગ, મેડિકલ, એન્જિનિયરિંગ પોસ્ટ ગ્રેજ્યુએશન, મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન, લો ગ્રેજ્યુએશન, લો માસ્ટર, PhD, CA અને સિવિલ સર્વિસ જેવી શાખાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ.

કેટેગરી	એક્ઝામ	યુવા રત્ન
સ્પેશિયલ	પી.એચ.ડી.	૩
પોસ્ટ ગ્રેજ્યુએશન	મેડિકલ	૨
પોસ્ટ ગ્રેજ્યુએશન	એન્જીનિયરીંગ	૧૨
પોસ્ટ ગ્રેજ્યુએશન	એલ.એલ.એમ.	૧
ગ્રેજ્યુએશન	મેડિકલ	૨૬
ગ્રેજ્યુએશન	ચાર્ટડ એકાઉન્ટ	૨૧
ગ્રેજ્યુએશન	એન્જીનિયરીંગ	૫૭
ગ્રેજ્યુએશન	એલ.એલ.બી.	૧
બોર્ડ	એચ.એસ.સી. (આર્ટ)	૬
બોર્ડ	એચ.એસ.સી. (કોમર્સ)	૧૬૬
બોર્ડ	એચ.એસ.સી. (સાયન્સ)	૨૯
બોર્ડ	એસ.એસ.સી.	૨૬૭

ટોટલ ૪૬૮ યુવા રત્નોએ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ૮૫% થી વધુ માર્કસ મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું છે.

તેમજ ૧૨૩ યુવા રત્નોએ વિવિધ ક્ષેત્રે ડીગ્રી હાંસલ કરીને પોતાની કારકિર્દીનો મજબૂત સ્તંભ ઊભો કરેલ છે.

સમાજ માટે ખૂબ જ ગૌરવશાળી એવા આ યુવા રત્નોમાં ૩ PhD, ૨ મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૨૬ ડોક્ટર, ૧૨ એન્જિનિયરિંગ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૨૧ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ૫૭ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ, ૧ લો ગ્રેજ્યુએટ, અને ૧ લો માસ્ટર ગ્રેજ્યુએટ નો સમાવેશ થાય છે.

રીજીયન	યુવા રત્ન
મુંબઈ	૬૪
દક્ષિણ ગુજરાત	૬૩
દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા	૫૮
તેલંગાણા-આંધ્ર પ્રદેશ	૫૭
દક્ષિણ ભારત	૫૨
દક્ષિણ કર્ણાટક	૩૬
સાબર	૩૬
મહાત્મા ગાંધી	૩૫
છત્રપતિ શિવાજી	૨૩
મધ્ય મહારાષ્ટ્ર	૨૨
છત્તીસગઢ	૨૨
કચ્છ	૨૨
ઉત્તર ગુજરાત	૧૪
વિદર્ભ	૧૩
મધ્ય પ્રદેશ	૧૨
સરદાર પટેલ	૧૨
ઉત્તર કર્ણાટક	૧૧
સૌરાષ્ટ્ર	૯
કચ્છ પૂર્વ	૮
ઓરીસ્સા	૮
સ્વામિ વિવેકાનંદ	૮
નવચેતન	૪
ઉત્તર ભારત	૨

આ યુવા રત્નોને દરેક રિજીયન પોતાની સામાન્ય સભામાં સન્માનિત કરી રહી છે. આ ગૌરવશાળી પ્રયાસ બદલ રિજીયન તેમજ એજ્યુકેશન અને ટેલેન્ટ હન્ટ ની ટીમને ખુબ ખુબ અભિનંદન.

આવનાર સમયમાં આ યુવા રત્નો પોતાની વિશેષ સિદ્ધિથી સમાજના સર્વાંગી વિકાસને વેગ આપશે તેવી શુભકામના સાથે સર્વ યુવા રત્નોને ખૂબ ખૂબ અભિનંદન.

કેન્દ્રીય યુવા સંઘ : મિશન એજ્યુકેશન અને ટેલેન્ટ હન્ટ : ૨૦૨૩-૨૫

એક અદભૂત નજારો... કચ્છમાં પાણી..પાણીનો આવ્યો હેલ્લારો

અમારા ગામ (નખત્રાણા)



ફોટ મહાદેવ - રામપર (રોહા)

નખત્રાણા ગામ વચેનો છેલો

નખત્રાણા આરામગૃહ અને વથાણ

મોડાસામાં મિશન અભિમન્યુ બાળ સંસ્કાર કેન્દ્રના બાળકોએ કર્યું વૃક્ષારોપણ

કેન્દ્રઃ બાલ સંસ્કાર કેન્દ્ર મોડાસા, રીજીયન - SBR. મિશન પ્રશિક્ષિકાઓ શ્વેતા ધોળું, લીના છાભૈયા, ભાવિકા લીંબાણી, હિના લીંબાણી, ધર્મિષ્ઠા રામાણી

મોડાસામાં દોઢ વર્ષથી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સંચાલિત મિશન અભિમન્યુ બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાથે આપણા પર્યાવરણની જાળવણીનું પણ જ્ઞાન આપવામાં આવે છે.

'धरती करे यही पुकार हरा भरा कर दो संसार।'
'जहां होती है हरियाली वहां होती है कुशहाली।'
'अगर जिंदगी को स्वस्थ और दीर्घायु बनाना है तो वृक्ष काटना नहीं बल्कि लगाना है।'

અને આ જ અંતર્ગત મોડાસા બાળ સંસ્કાર કેન્દ્રમાં મિશન અભિમન્યુના પ્રશિક્ષકાઓ દ્વારા પ્રકૃતિ નું શું મહત્વ છે, અને પ્રકૃતિથી જીવસૃષ્ટિ ટકી રહે છે, આ સમજાવી બાળકોમાં પ્રકૃતિ પ્રેમ જાગે અને બાળકો વૃક્ષોનું જતન કરતાં શીખે માટે વૃક્ષારોપણનું આયોજન થયું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૪૦ બાલકો એ ભાગ લીધો. દરેક બાળક પોતાના ઘરથી જ છોડ લઈને આવ્યા હતા. જેમાં લીમડો, આસોપાલવ, બોરસલી, જાસુદ,કરેણ, બિલિપત્ર, ચંપો, તેમજ કેટલાક બાળકો ફૂલછોડ પણ લાવ્યા હતા. ઉમિયા મંદિરના પ્રતાંગણમાં દરેક બાળકે પોતાનાં હાથે જ છોડ વાવ્યા. મિશનની પ્રશિક્ષકતાઓ દ્વારા દરેક બાળકને શપથ લેવડાવવામાં આવી અને બાળકોએ પણ સહર્ષ શપથ ગ્રહણ કરીકે. અમે રોજ આ છોડને જ્યાં સુધી મોટા ન થઈ જાય ત્યાં સુધી રોજ તેમને પાણી આપીશું.

સંકલનઃ લીના છાભૈયા, મોડાસા

હૈદરાબાદમાં નખત્રાણા રહેવાસી સનાતન પરિવાર સંગઠનની જનરલ સભા
પ્રમુખશ્રી મોહનભાઈ કેસરાણીના અધ્યક્ષ સ્થાને સભાનું આયોજન

શ્રી નખત્રાણા સનાતન સમાજ, હૈદરાબાદની વાર્ષિક સામાન્ય સભા ગત રવિવાર તા. ૨૧-૦૭-૨૦૨૪ના રોજ મારૂતિ સનસીટી, જીડીમેટલા, હૈદરાબાદ મધ્યે પ્રમુખશ્રી મોહનભાઈ કેસરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.

મહામંત્રી કાંતિભાઈ નાથાણીએ હોદ્દેદારશ્રીઓને સ્થાન ગ્રહણ કરાવેલ અને પ્રભુ પ્રાર્થના સાથે સભાના શરૂઆતમાં પ્રમુખશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ દિવંગત થયેલા સભ્યો માટે બે મિનિટ નું મોન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી.મહામંત્રી કાંતિભાઈ નાથાણીએ ગત સામાન્ય સભાની મિનિટસનું વાંચન કરેલ, તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

સભામાં ઉપસ્થિત વડીલોની પસંદગી સમિતિની નિમણૂંક કરી વર્તમાન કારોબારી સમિતિએ રાજીનામું આપી વર્ષ ૨૦૨૪-૨૭ માટે નવી કારોબારી સમિતિની રચના કરવા માટે મંજુરી આપી હતી. પસંદગી સમિતિએ નીચે પ્રમાણે નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ.

પ્રમુખશ્રી : રમેશભાઈ વિશ્રામ રાજાણી
ઉપપ્રમુખશ્રી : ઈશ્વરભાઈ નારણ દિવાણી
મહામંત્રી : કાંતિલાલ ધનજી નાથાણી
સહમંત્રીઃ છગનલાલ કરમશી લીંબાણી
ખજાનચી : અમૃતભાઈ માવજી કેસરાણી
સહજાનચીઃ પ્રવીણભાઈ મણીલાલ પાંચાણી

કારોબારી સભ્યો
લલિતભાઈ મેઘજી લીંબાણી
કિશોરભાઈ દેવજી છાભૈયા
પ્રભુદાસ વાલજી પાંચાણી
ભાવેશભાઈ મોહન કેસરાણી



નવનિયુક્ત પ્રમુખશ્રી રમેશભાઈ રાજાણી

નવનિયુક્ત મહામંત્રી કાંતિભાઈ નાથાણી

વસંતભાઈ વેલજી પાંચાણી
યોગેશભાઈ ગંગારામ નાથાણી
મોહિતભાઈ નવીન પાંચાણી

મહિલા કારોબારી સભ્યશ્રીઓ
જયાબેન કિશોર દિવાણી
મીનાબેન અરવિંદ જબુઆણી
વર્ષાબેન ખીમજી રાજાણી
સુનીતાબેન અમૃત કેસરાણી
પ્રજ્ઞાબેન ભરત પાંચાણી
તારાબેન ઈશ્વર રામાણી

સંકલન :
સહમંત્રી- છગનલાલ કરમશી લીંબાણી
સંયોજક : જસવંત સુરાણી સિકંદરાબાદ

હૈદરાબાદ ખાતે ઉજવાયો નવકુંડી મહાયજ્ઞ

હૈદ્રાબાદ મહિલા મંડળના નેતૃત્વ તથા સહયોગથી યુવાસંઘના TAP રિજીયનની સામાજિક અને આધ્યાત્મિક સમિતિએ બહેનો સાથે મળીને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પાટીદાર ભવન કોત્તાપેટમાં દ્વિ-દિવસીય નવકુંડી મહાયજ્ઞ

આશીર્વચન આપતા શ્રી નમસ્વી દીદી

કાર્યક્રમનું તારીખ ૧૫/૦૭/૨૦૨૪, સોમવારના રોજ આયોજન કરેલ.

નવકુંડી મહાયજ્ઞમાં ખૂબ સારી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલ. આ સાથે આયોજકો દ્વારા ગર્ભ સંસ્કાર કાર્યક્રમ કરેલ. જેમાં બહેનોને ગાયત્રી માંનું અનુસંધાન દ્વારા ગર્ભ સંસ્કારથી આવનાર શિશુમાં સારા સંસ્કારનું સિંચન કરેલ.

ગર્ભસંસ્કાર ધારણ કરેલ બહેનોને આર્શીવાદ આપતા વડીલ માતાઓ

દ્વિતીય દિવસે મંગળવારના રોજ નામસ્વી દીદીના સાનિધ્યમાં એમના સુમુધુર વચનો દ્વારા આધ્યત્મિક જ્ઞાન મેળવ્યુ.

વિથોણ ગામનું ગૌરવ
સમગ્ર કચ્છમાં સૌથી ઉંચી પ્રતિમા

વિથોણ ગામમાં તળાવમાં હનુમાનજીની વિરાટ મૂર્તિ બિરાજમાન છે. અતિ ભવ્ય અને ઋજુ સૌન્દર્ય ધરાવતી આ પ્રતિમા સંત ખેતાબાપાના પવિત્ર પરિસરમાં તળાવની વચ્ચે બિરાજમાન છે.

ચોમાસા દરમ્યાન જયારે તળાવ પૂર્ણ ભરેલ હોય છે ત્યારે આ પ્રતિમા વધુ મનમોહક અને નમણી લાગે છે છે. આ સહયોગથી આ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવેલ. પ્રતિમા તળાવની સપાટીથી ૭૧ ફૂટ અને બેઠક/પાટલા થી ૫૧ ફૂટ ઉંચી છે.

પ્રતિમાને લીધે સમગ્ર પરિસર એક પ્રવાસન ધામ બની ગયું છે. જેથી માત્ર સાતમ-આઠમ જ નહી પણ અન્ય દિવસોએ કચ્છમાં આવનાર સમાજજનો આ સ્મારકની મુલાકાત લે છે.

દાતા શ્રી મેઘજીભાઈ દેવશીભાઈ નાકરાણી પરિવાર (મુંબઈ/વિથોણ)ના

અહીં રોજ સવારે હનુમાન ચાલીસા અને સાંજે મહા આરતી થાય છે. જેનો લાભ દરેક પ્રવાસીઓ અચૂક લેતા હોય છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લેતા પરિસરના વ્યવસ્થાપકોએ સુંદર બેઠક વ્યવસ્થા અને સેલ્ફી પોઈન્ટ બનાવેલ છે.

પલુસ યુવા મંડળે ૪૦ રોપાઓનું જતન સાથે કર્યું વાવેતર

તારીખ- ૨૧/૦૭/૨૦૨૪ નાં યુવા મંડળ, પલૂસ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ. જેમાં આંબો, સીતાફળ, વડ આદિ અલગ અલગ જાતના રોપાનું વાવેતર કરવામાં આવેલ. એની સાથે યુવા મંડળના ભાઈઓએ વાવેલ રોપાનું જતન અને સારી રીતે માવજત કરવાની શપથ લીધેલ અને સર્વે ભાઈઓએ મળીને ૪૦ રોપાનું વાવેતર કર્યું જેમાં કૃષિ અને પર્યાવરણ થીમ કન્વીનર અરત્ન મૈયાતની વિશેષ ઉપસ્થિતિ રહેલ.

PRO - કિશન ધોળુ.

બજેટ સ્પેશિયલ

સસ્તું થયુ
સોના અને ચાંદી પર ૬% ડ્યુટી
પ્લેટિનમ પર ૬.૪% ડ્યુટી
કેન્સરની ૩ દવાઓ
મોબાઈલ ફોન અને ચાર્જર પર ડ્યુટી ૧૫%
૨૫ મહત્વપૂર્ણ ખનિજો પરની ડ્યુટી નાબૂદ
માછલી ખોરાક
ચામડાની વસ્તુઓ,ચામડાના ચંપલ, પર્સ
રાસાયણિક પેટ્રોકેમિકલ
એક્સ-રે મશીનો
મોબાઈલ ફોનના પાર્ટસ
સોલાર પેનલ
સોલાર સેલ
ઈલેક્ટ્રિક કાર
ઈમ્પોર્ટેડ જ્વેલરી

મોંઘુ થયુ
પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ
પેટ્રોકેમિકલ
એમોનિયમ નાઈટ્રેટ
પીવીસી
હવાઈ મુસાફરી
સિગારેટ
ટેલિકોમ ઉપકરણો

આવકવેરાનો નવો દર

₹૦ થી ૩ લાખ સુધી	૦% ટેક્સ
₹૩ થી ૭ લાખ સુધી	૫% ટેક્સ
₹૭ થી ૧૦ લાખ સુધી	૧૦% ટેક્સ
₹૧૦થી ૧૨ લાખ સુધી	૧૫% ટેક્સ
₹૧૨થી ૧૫ લાખ સુધી	૨૦% ટેક્સ
₹૧૫ લાખથી વધુ	૩૦% ટેક્સ

કરાડ સમાજમાં દેવદર્શન પ્રવાસનું આયોજન

તા ૧૪/૦૭/૨૦૨૪ રવિવારનાં કરાડ ગ્રામિણ સમાજના યુવા મંડળ, મહિલા મંડળ અને સમાજના વડીલો સર્વે મળી એક દિવસીય દેવદર્શન સહ પર્યટન નું આયોજન કરવામાં આવેલ જેમાં ...
ભાવલીંગ મહાદેવ મંદિર- વડુજ
કપુરેશ્વર મહાદેવ પ્રાચીન મંદિર
શામગાવ ઘાટ- મસૂર
સંત રામદાસ મારૂતી મંદિર, શહાપુર
શ્રીરામ મંદિર ચાફળ
પ્રાચીન શિવમંદિર ઉરૂલ ઘાટ

આદિ મંદિરોમાં જલાભિષેક, પુજા- પ્રાર્થના કરેલ. દેવદર્શન ની સાથે ઘાટ પરિસરમાં આવેલ ઝરણાં તથા ધબધબાઓનો આનંદ માણ્યો. સંપુર્ણ ટ્રીપને સફળ બનાવવા મંડળના પ્રમુખશ્રી મણિભાઈ પોકારે ભારે જહેમત કરી સર્વેની વાહ વાહ મેળવેલ. ફરી આવા આયોજન કરતા રહો એવી ભાવના સાથે સૌ ટ્રીપનો આનંદ માણી છૂટા પડ્યા.

કન્વીનર- કાંતીલાલ રામાણી
PRO -અરવિંદ જબુવાણી.

આર્થિક સ્નાતકથી લઈને ભારતના નાણા પ્રધાન સુધીની સફર - નિર્મલા સીતારમણ

ગત રોજ મંગળવારે મહિલા સશક્તિકરણ ઉદાહરણ નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો..

નિર્મલા સીતારામન (જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૫૯) ભારતીય રાજકારણી જે હાલમાં નાણાપ્રધાન અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપે છે, તેઓ ભારતનાં રક્ષામંત્રી પણ હતા. ૨૦૧૪ થી ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે. સિતારામન ભારતની બીજી મહિલા સંરક્ષણ પ્રધાન છે અને ઈન્દિરા ગાંધી પછી બીજી મહિલા નાણાં પ્રધાન પણ છે. તેમણે નાણા મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સ્વતંત્ર ચાર્જ સાથે નાણાપ્રધાન અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપી છે. તે પહેલાં, તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સેવા આપી હતી.

નિર્મલા સીતારામન ૨૦૦૮ માં ભાજપમાં જોડાયા ત્યારે તેમણે પક્ષના પ્રવક્તા તરીકે સેવા આપી, ૨૦૧૪ માં તેમને એક કનિષ્ઠ પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા,,૧૧ જુન ૨૦૧૬ ની રાજ્ય સભાની ચૂંટણી માટે, મે ૨૦૧૬ માં ભાજપે ૧૨ ઉમેદવારોની નિયુક્તી કરી હતી, જેમા એક નિર્મલા સીતારામન હતા. તેમણે સફળતાપૂર્વક કર્ણાટકમાંથી તેમની બેઠક લડી ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ, તેમને રક્ષા મંત્રી તરીકે ઉભા કરવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધી પછી, નિર્મલા સીતારામન માત્ર બીજી મહિલા છે, જે રક્ષા મંત્રીનુ પદ ધરાવતા હતાં.

૩૧ મે, ૨૦૧૯ ના રોજ, નિર્મલા સીતારામનને નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે નિમવામાં આવ્યા. તે ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણા પ્રધાન. તેમણે ૫ જુલાઈ, ૨૦૧૯ ના રોજ ભારતીય સંસદમાં તેમના પ્રથમ બજેટ રજૂ કર્યા.

રાજકીય ક્ષેત્રની બહાર, સીતારામને યુ.કે.માં, કૃષિ ઈજનેર એસોસિએશનના એક અર્થશાસ્ત્રીને સહાયક તરીકે સેવા આપી છે. યુ.કે.માં તેમના રોકાણ દરમિયાન, તેમણે પ્રાઈઝ વોટરહાઉસ માટે સિનિયર મેનેજર (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) અને બીબીસી વર્લ્ડ સર્વિસમાં સંક્ષિપ્ત સેવા આપી છે. તેમણે નેશનલ કમિશન ફોર વિમેનના સભ્ય તરીકે પણ સેવા આપી છે. ૨૦૧૭ થી, તેઓ હૈદરાબાદના પ્રણવ સ્કૂલના સ્થાપક દિગ્દર્શકો પૈકી એક છે.

તમિલનાડુ સિનીયર રોલ બોલ ચેમ્પિયન વિજેતા સ્નેહા લીંબાણી, વેલુર

કચ્છમાં નાગવીરી, હાલે- વેલુર નિવાસી લક્ષ્મીબેન હંસરાજભાઈ દેવજીભાઈ લીંબાણીની સુપુત્રી કુ. સ્નેહા લીંબાણી ૧૨મી તમિલનાડુ રાજ્ય સિનિયર રોલ બોલ ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ તૃતીય સ્થાન મેળવી માતા પિતા, પરિવાર તેમજ સમાજ નું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.



કુમારી સ્નેહા.. હાલમાં કોલેજ 2nd year B.TECH Food technology નો અભ્યાસ સાથે સ્પોર્ટ્સ તમિલનાડું રોલ બોલ એસોસિયેશન અંતર્ગત ૧૨મી તામિલનાડુ રાજ્ય સિનિયર રોલ બોલ ચેમ્પિયનશિપ વેંકટલક્ષ્મી રોલ બોલ ગ્રાઉન્ડ, સિંગનાલ્લુર, કોઈમ્બતુર Sama - ૨૦ થી ૨૧ જુલાઈ ૨૦૨૪ માં સહભાગી થઈ અને સ્પોર્ટ્સ જગતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે.

ટીમ પ્રચાર અને પ્રસાર સમિતિ વતી વિશેષ સિદ્ધિ મેળવ્યા બદલ અભિનંદન સાથે ઉતરોતર રમત ગમતના ક્ષેત્રમા પ્રગતિ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન આપે એવી શુભકામના અને શુભેચ્છાઓ પાઠવે છે.

મોબ: ૯૪૪૨૨૨૪૯૭૨

ચાંદીપુરા વાયરસ વિશે સંપૂર્ણ માહિતી તેનાથી બચવાના ઉપાયો

તમારા દરેક ગ્રુપમાં આ માહિતી મોકલો, કોઈ બાળકનો જીવ બચી જશે.

ચાંદીપુરા વાયરસ શું છે? આ એક જીવલેણ વાયરસ છે જે ચાંદીપુરા વાયરલ રોગનું કારણ બને છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે. વાયરસ અને રોગ વિશે કેટલીક મુખ્ય વિગતો :

વાઈરસ
Rhabdoviridae કુટુંબનું છે. ૧૯૬૫ માં ચાંદીપુરા ગામ, મહારાષ્ટ્ર, ભારતથી મલી આવેલ. વાયરલ જીનોમ સિંગલ-સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે.
- ચાંદીપુરા વિષાણુ થી થતો રોગ
- સેવન સમયગાળોઃ ૨-૭ દિવસ
- મૃત્યુ દરઃ જો સારવાર ન કરવામાં આવે તો ૫૦-૮૦%

સંક્રમણ કંઈ રીતે ફેલાય
- વેક્ટરઃ સેન્ડફ્લાય (ફ્લેબોટોમસ એસપીપી.)
- પશુ યજમાનઃ ચામાચીડિયા, ઉંદરો અને અન્ય નાના સસ્તન પ્રાણીઓ
- માનવ-થી-માનવ ટ્રાન્સમિશનઃ દુર્લભ, પરંતુ ચેપગ્રસ્ત શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા શક્ય છે

લક્ષણો :
- તાવ, - માથાનો દુખાવો, - સ્નાયુમાં દુખાવો, - સાંધાનો દુખાવો, - રક્તસ્રાવની વૃત્તિઓ (પેટેચીયા, એકીમોસિસ, હેમેટેમેસિસ), - ન્યુરોલોજીકલ લક્ષણો (ગૂંચવણ, ઉશ્કેરાટ, ખેંચ)

નિદાન કઈ રીતે કરવું
- પીસીઆર (પોલિમરેઝ સાંકળ પ્રતિક્રિયા)
- ELISA (એન્ઝાઇમ-લિંકડ ઇમ્યુનોસોર્બન્ટ એસે)
- વાયરસ અલગતા

સારવારઃ
- સહાયક સંભાળ (પ્રવાહી રિપ્લેસમેન્ટ, ઓક્સિજન ઉપચાર)
- એન્ટિવાયરલ થેરાપી (?રિબાવિરિન)
- પ્રાયોગિક સારવાર (નસમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન)

નિવારણઃ
- વેક્ટર નિયંત્રણ (જંતુનાશકો, repellant)
- વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (માસ્ક, મોજા, મચ્છરદાની)
- ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા માણસો સાથે સંપર્ક ટાળવો

ચાંદીપુરા વાયરસ એ અત્યંત જીવલેણ વાયરસ છે, અને જો લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી ધ્યાન જરૂરી છે. નિવારણ અર્થે વેક્ટર નિયંત્રણ પગલાં બચાવ માટે નિર્ણાયક છે.

સાવચેત રહો સલામત રહો

મિશન અભિમન્યુ ચતુર્થ ચરણ
મિશન વિવેકાનંદાનું ઓનલાઈન સત્ર

તારીખ - ૨૦/૦૭/૨૪
સમય - ૩:૩૦ - ૪:૩૦
વિષય - ગુરુ નો મહિમા
મુખ્ય પ્રશિક્ષક - ભાવના ભાવાણી, રાજનાંદગાવ
સંચાલક - ચંચલ નાકરાણી (ઈન્દૌર)
તકનીકી સહાયક - જુહી છાભૈયા (બડનેરા)

ગત શનિવારના રોજ મિશન અભિમન્યુના ના ચતુર્થ ચરણ - મિશન વિવેકાનંદા નું ઓનલાઈન સત્ર ભાવનાબેન દ્વારા લેવામાં આવેલ જેનો વિષય.. "ગુરુની મહિમા."

સર્વપ્રથમ ભાવનાબેનના મધુર સ્વરો દ્વારા મંગલા ચરણ પાઠ કર્યા બાદ તેમને રામાનુજાચાર્ય અને શંકરાચાર્યની જ્ઞાનપ્રદ કથાઓ સંભળાવી સત્સંગ સભામાં આગળ વધતા... ગુરુ જ્ઞાનગંગા માં ડુબકી મારતા ભાવનાબેને સમજાવ્યું કે ગુરૂની કૃપાથી જ અહંકારનો નાશ થાય અને શિષ્યના જીવનમાં નમ્રતા આવે. શિષ્યના જીવનમાં ગુરુ એક ચિકિત્સકની ભુમિકા નિભાવે છે. મન, કર્મ અને વચન થી ગુરુ ને સમર્પિત શિષ્યને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે.

ગુરુ ગોવિંદ દૌઉ ખડે, કાકો લાગુ પાય
બલિહારી ગુરુ આપ જો, ગોવિંદ દિયો બતાય

ગુરુ કૃપાથી જ પરમાત્મા થી મિલન થાય છે. સદગુરુની ચેતના સંપુર્ણ બ્રહ્માંડમાં ફેલાયેલી છે. ભાવનાબેનના મુખે થી આવા જ્ઞાનભર્યા શબ્દોના ફૂલોથી સભા નું વાતાવરણ મહકી ઉઠ્યું. જ્ઞાન સભામાં ૪૦ બહેનો એ ઉત્સાહ સાથે ભાગ લીધેલ. સભામાં વિશેષ રૂપે સહભાગી સત્સંગી બહેનો :
ચંચલ નાકરાણી (ઈન્દૌર)
નમિતા માધાણી (ગોવા)
લીલાબેન (કલકત્તા)
નર્મદાબેન (રાજનાદગાંવ)

અંતમાં સભામાં ઉપસ્થિત બહેનો નું આત્મીય ધન્યવાદ પાઠવતા લક્ષ્મીનારાયણ ભગવાન ની જયઘોષ સાથે રાષ્ટ્રગાન કરી સભાને વિરામ આપ્યું.

પૂર્ણ મિશન અભિમન્યુ ટીમ સંગ અખિલ ભારતીય મહિલા અને યુવાસંઘ.

સંકલન : અનિતા ધોધારી, ઈન્દૌર.
સંયોજક : નમિતા માધાણી, ગોવા.

અવસાન નોંધ

તારીખ : ૨૩/૦૭/૨૦૨૪

સ્વ. હાર્દિકભાઈ વિસનજીભાઈ માવાણી
ઉંમર : ૨૮ વર્ષ, કચ્છમાં : દેશલપર (વાંઢાય), હાલે : અમીરગઢ (બનાસકાંઠા)

સ્વ. ડાહીબેન વિશ્રામભાઈ ભાવાણી
ઉંમર : ૯૨ વર્ષ, કચ્છમાં : ઐયર, હાલે : બારડોલી

સ્વ. મંજુલાબેન ધનજીભાઈ રંગાણી
ઉંમર : ૮૦ વર્ષ, કચ્છમાં : દયાપર, હાલે : બારડોલી

ॐ નમો નારાયણાય
સંન્યાસ: કર્મયોગશ્ચ નિ:શ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મસંન્યાસાત્ કર્મયોગો વિશિષ્યતે
શ્રીમદ ભગવદગીતા (અ.૫-૨)
કર્મનો ત્યાગ અને કર્મયોગ એ બન્ને જ પરમકલ્યાણકારી છે, પરંતુ તે બેમાંથી કર્મના ત્યાગ કરતાં નિષ્કામકર્મ વધારે શ્રેષ્ઠ છે.
જ્ઞાનદર્શક સંતશ્રી વલ્લભકૃષ્ણના જય શ્રી લક્ષ્મીનારાયણ

નર્મદાની રાહ ન જોઇને ખેડૂત ખારાં પાણીને મીઠાં કરવાની મહેનત કરે તો કામ રૂડું મજાનું થાય...

કચ્છની ખેતી કુદરતના કોપથી ફસાતી રહી છે. ક્યારેક આભથી આફત જેમ અનહદ વરસતાં વાદળોની વેદના રૂપે અતિવૃષ્ટિ અકળાવે છે, તો ક્યાંક કિસાન જમીનમાંથી ખારાં પાણીની પીડા વેઠે છે, ત્યારે નર્મદાનાં પાણીની રાહ જોઇને બેસી નહીં રહેતાં પોતાનું પાણી બતાવનારા કચ્છના પાણીદાર યુવા કિસાને ખારાં પાણીને મીઠું કરવાની કમાલ કવાયત કરી છે અને તેમાં સફળતા પણ મેળવી છે.

છેક સ્પેનમાં એમબીએનો ઉચ્ચ અભ્યાસ કરી આવ્યા પછી કોઇ કોર્પોરેટ કંપનીમાં કારકિર્દી ઘડવાનાં સ્થાને વાડી-ખેતરમાં વસી જઇને કિસાન તરીકે કારકિર્દી ઘડનારા સ્મિત જિજ્ઞેશભાઇ દેઢિયાની ઉંમર હજુ નાની કહી શકાય, પરંતુ આ ઉંમરે તેણે કરી બતાવેલું કામ જરૂર મોટું કહી શકાય.

હૈયું-મસ્તક-હાથ કામે લગાડીને ૩૨ વર્ષના સ્મિતે માંડવી તાલુકાનાં ગઢશીશામાં ૧૪ એકર જમીનમાં ખેતી કરવા માટે 'રેડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ' તૈયાર કર્યો છે.

પરિશ્રમપૂર્વક કરેલા પ્રયોગનાં સફળ પરિણામ મેળવતાં બે વર્ષ લાગી ગયાં. કચ્છની ખારાશવાળાં પાણીનો પડકાર સહન કરી ખેતી કરનારા ખેડૂતો માટે આ પહેલ પ્રેરક છે.

તળપદી ભાષામાં કહીએ તો કાંધાવાળાં લાલ (ખારાશવાળા) પાણીને પાક માટે પોષણક્ષમ બનાવવા માટેનો વ્યાયામ હાથ ધરનારા શિક્ષિત યુવા કિસાન સ્મિત દેઢિયાએ અઢી લાખ લિટર પાણી સમાવવાની ક્ષમતાવાળો એક હોજ બનાવ્યો છે અને 'રેડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ'માં ચાર ફિલ્ટરની ચેમ્બર્સ ઊભી કરી છે. આ પ્લાન્ટની સફાઇ માટે આઠ વાલ્વ પણ મુકાયા છે.

પ્લાન્ટને બોર સાથે જોડી દેવાયો છે. બોરનું ખારાશવાળું પાણી ચાર ચેમ્બરમાંથી ઉપર-નીચે થઈને ગ્રેવિટી ફિલ્ટરેશન (ગુરુત્વાકર્ષણની મદદથી) દ્વારા એન્ટિ ગ્રેવિટી ફિલ્ટરેશન (ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ રીતે)ની મદદથી ગાળીને શુદ્ધીકરણ કરાય છે.

આ રેડ વોટર ટ્રીટમેન્ટની પ્રક્રિયામાં રેતી કે મોંઘા પડતા કોલસા નહીં, પરંતુ અલગ-અલગ ગ્રેડની કાંકરી પ્લાન્ટમાં સ્મિતે નાખી છે.

ધોળાવીરામાં ઉત્ખનન બાદ મળેલી સાઇટમાં જે રીતે પાણીનું શુદ્ધીકરણ કરાતું હતું, તેવી જ પ્રણાલીના અણસારવાળી ટેકનિક અજમાવાઇ છે.

શિક્ષિત ધરતીપુત્ર કહે છે કે, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનાં થોડાં-ઘણાં જ્ઞાનની સાથોસાથ પોતાની સૂઝ કામે લગાડતાં આ પ્રયોગને બે વર્ષની મહેનતના અંતે સફળતા મળી.

આ રેડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની હાઇ-ટેક પ્રણાલીના લાભ અંગે વાત કરતાં સ્મિત કહે છે કે, ખારાશવાળાં પાણીથી ડ્રિપ ચોકઅપ થાય છે. જેને સાફ કરવી ભારે મુશ્કેલ બની રહે છે, ત્યારે આ પ્લાન્ટ પાણીમાંથી ખારાશને દૂર કરતો હોવાથી તેનાથી ડ્રિપ ચોકઅપ (ભરાઇ જતી) થતી નથી.

હોજ માટે સબસિડી છે; ફિલ્ટર માટે પણ આપો

સરકારે ખેડૂતોને સબસિડી આપવા માટે વિવેકપૂર્ણ વર્તવું જોઇએ. ખરેખર જ્યાં જરૂર છે, ત્યાં મદદ કરવાની જરૂર છે. વાડી-ખેતરમાં હોજ બનાવવા માટે સબસિડી છે, પરંતુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર-ચેમ્બર બનાવવા માટે નથી, જે સરકારે આપવી જોઇએ, તેવું મહત્ત્વપૂર્ણ સૂચન સ્મિત દેઢિયા કરે છે.

નર્મદાની કેનાલ ગઢશીશાના વાડી-ખેતરોવાળા ભાગોમાં નથી આવવાની, તો જ્યાં સરકાર નર્મદાનું પાણી પહોંચાડી નથી શકવાની, તેવી ખારાં પાણીવાળી ભૂમિ માટે રેડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરવા ઇચ્છતા કિસાનોને 'નર્મદાનાં નીરના વિકલ્પ' રૂપે સબસિડીનો સહયોગ સરકારે આપવો જોઇએ. તેવી સુંદર વાત સી.એ. પિતાના 'કિસાનપુત્ર'એ કરી છે.

અત્યારે અઢી લાખ લિટર પાણીના હોજ દ્વારા ૧૪ એકર જમીનમાં પાક પોંખતો સ્મિત કહે છે કે, હોજ બાંધવા પાછળ ત્રણેક લાખ અને ફિલ્ટર્સના સવાથી દોઢ લાખ મળીને સાડા ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચ થાય તેમ છે.

આટલો ખર્ચ નહીં કરી શકતા નાના ખેડૂતને ફિલ્ટર માટે સબસિડી અને શક્ય હોય તો બાકીની રકમની વ્યાજ વગરની લોન આપીને મદદ કરી શકાય.

કચ્છમાં ધમધમતા ઉદ્યોગ ગૃહો પણ આવા ટેક્નોલોજિકલ નવતર પ્રયોગોને પીઠબળ પૂરું પાડવા આગળ આવે તો કામ રૂડું મજાનું થાય.

કચ્છમાં માંડવી તાલુકાનાં ગઢશીશામાં ૧૪ એકર ભૂભાગ પર સંપૂર્ણપણે ગાય આધારિત ખેતી કરતા યુવાન સ્મિત દેઢિયા વિશે એક વાત ખાસ જાણવા જેવી છે. ખાસ ભણવા માટે ભારે ઉત્સાહભેર છેક સ્પેન પહોંચી ગયેલા સ્મિતે ત્યાંથી ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ (વૈશ્વિક ઉદ્યોગ સાહસિકતા) અને સ્ટાર્ટઅપ મેનેજમેન્ટ જેવા વિષયો સાથે એમબીએનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.

ખેતી કરવામાં ઇઝરાયલની પ્રણાલીનું પાલન કચ્છના કિસાનો કરશે તો એક સમય એવો જરૂર આવશે કે દેશ જ નહીં, દુનિયાભરના કિસાનો ખેતી જોવા, શીખવા કચ્છ આવશે, તેવું ઉત્સાહી ખેડૂત કહે છે.

છેલ્લાં પાંચેક વર્ષથી ખેતી કરતો ૩૨ વર્ષીય સ્મિત આજની યુવા પેઢીને એવી સોનેરી સલાહ આપે છે કે, સદ્ભાગ્યે મારા પૂર્વજો કિસાન હોવાથી જમીન હતી, પરંતુ જમીન ન હોય તો પણ ખેતી કરી શકાય.

છેક સ્પેનથી એમબીએની ડિગ્રી લઇ આવેલા 'ટેકનોક્રેટ' યુવા કિસાન સ્મિત દેઢિયાએ બનાવેલો 'રેડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ' કચ્છના ખેડૂતોએ જોવા જેવો, કરવા જેવો છે

આપણા રાજ્યના કાયદા - નિયમ ધ્યાનમાં રાખીએ તો જમીન લીઝ પર લઇને પણ યુવાનો ખેતી કરી શકે છે.

મેં એમબીએ કર્યું, જેમાં એક વિષય હતો સ્ટાર્ટઅપ મેનેજમેન્ટ, મારી ખેતી પણ એક સ્ટાર્ટઅપ જ છે. મેં કંઇ બેઠા બેઠા ખેતી નથી કરી. શરૂઆતમાં છ મહિના રિસર્ચ (સંશોધન), વાડી-ખેતરની મુલાકાત, દેશભરના કિસાનોને મળીને માહિતી, સમજણ એકઠા કરવાની કવાયત કરી છે, તેવું પ્રયોગશીલ કિસાન કહે છે.

કોઠારા સ્થિત વિભાગીય સંશોધન કેન્દ્રના અભ્યાસુ અને વિચારશીલ સંશોધક વૈજ્ઞાનિક ડૉ. દિનેશભાઇ જી. પટેલ કહે છે કે, સ્મિત જેવા કિસાનોની પ્રયોગશીલતાને પીઠબળ મળે તો કચ્છના દરેક કિસાનના ચહેરે સ્મિત જોવા મળે.

H.K. DOORS

HK DOORS
First IMPRESSION of your HOUSE
HEAD OFFICE
Sri Narayan Timber, Survey No. 186/187, Plot No. 7,8,9, Chudva Gandhidham - 370201, Kutch, Gujarat - India.
Hareshbhai Rudani - Mo. +91 99791 57883
BRANCH OFFICE
1. DHARWAD - KARNATAKA
Kishorbhai - Mo. +91 94826 95508
2. HYDERABAD - TELANGANA
Bhaveshbhai - Mo. +91 78934 59459
3. CHENNAI - TAMILNADU
Vivekbhai - Mo. + 91 98843 12266
Janakbhai - Mo. +91 98413 88663
4. VIJAYWADA - ANDHRA PRADESH
Rajeshbhai - Mo. +91 78428 05202
5. MARGAO - GOA : Kirtibhai - Mo. +91 70202 74705

KishorBhai Rudani: 9979352929
H.K. TIMBER PVT. LTD.
TIMBER IMPORTER AND ORDER SUPPLIERS
HEAD OFFICE
Survey No. 186/187 Plot No. 6
Gandhidham - 370 201, Kutch, Gujarat - India.

PRAMUKH ENTERPRISE
EXPOTER AND TIMBER IMPORTER
HEAD OFFICE
Flat No. 3, Ground Floor, Plot No. 26, Sector - 3, Matru Chhaya Appartment, Gandhidham Kutch, Gujarat - 370 201.
Bharatbhai Rudani - Mo. +91 99791 57884

H.K. FRUITS
HEAD OFFICE
45, Gopalnand Chock, Gunatitpur, Kumbharadi, Kutch, Gujarat - 370 140.
Jagdishbhai Rudani - Mo. + 91 99254 98648
Dhirajbhai Rudani - Mo. + 91 99784 49205